

વનરક્ષક ભરતી ૨૦૧૬

ત્રીજા તબક્કાના શારિરીક ક્ષમતા કસોટી અન્વયે જરૂરી સુચના

વનરક્ષક ભરતી ૨૦૧૬ અન્વયે ત્રીજા તબક્કાના શારિરીક ક્ષમતા કસોટી અંગે લાગતા વળગતા ઉમેદવારોનું નીચેની બાબતો ધ્યાન પર મૂકવામાં આવે છે.

- (1) ત્રીજા તબક્કાના શારિરીક ક્ષમતા કસોટી માટે બોલાવવામાં આવનાર ઉમેદવારોની યાદી વન વિભાગની વેબસાઇટ <https://forests.gujarat.gov.in> પર રજૂ કરવામાં આવેલ છે
- (2) દરેક જિલ્લા માટે નિયત થયેલ કેટેગરીવાર જગ્યાઓ તથા ૧૦% પ્રતિક્ષા યાદીને ધ્યાનમાં રાખીને પ્રથમ અને દ્વિતિય તબક્કાની શારિરીક ક્ષમતા કસોટીમાં ઉત્તિર્ણ થયેલ ઉમેદવારોને સરકારશ્રીના વિવિધ નિયમો અંતર્ગત કેટેગરીવાર ઉત્તિર્ણ ઉમેદવારોને સરભર કર્યા બાદ ખાલી રહેતી જગ્યાઓ સામે જે તે કેટેગરીમાં લેખિત પરિક્ષા અને નિયમોનુસાર મળવાપાત્ર ગ્રેસ માર્કને આધારે તૈયાર કરેલ મેરિટ યાદીમાંથી ૧૬ (સોળ) ગણા ઉમેદવારોની સંખ્યા ગણવામાં આવેલ છે.
- (3) ત્રીજા તબક્કાના શારિરીક ક્ષમતા કસોટી માટે બોલાવાયેલ ઉમેદવારોને તેમણે અરજીમાં ઉલ્લેખ કરેલ મોબાઇલ નંબર પર NIC દ્વારા SMS થી જાણ કરવામાં આવે ત્યાર બાદ ઓજસની વેબસાઇટ <https://ojas.gujarat.gov.in> ઉપરથી તેમના કોલલેટર ડાઉનલોડ કરવાના રહેશે.
- (4) જે ઉમેદવારોના નામ યાદીમાં સામેલ હોય અને નિયત તારીખના એક દિવસ અગાઉ સુધી કોલ લેટર ડાઉન લોડ ન થઈ શકે તો નીચેના નંબર પર અથવા એ-મેઇલ પર પૂછપરછ કરી શકાશે.
- (5) ઉપરોક્ત સ્પષ્ટતાઓ છતાં કોઈ ઉમેદવારની ચોકકસ રજુઆત હોય તેમણે તેમના અરજી નંબર/ કન્ફર્મેશન નંબર અને માર્કસને આધારે નીચે પ્રમાણેના ઇ-મેઇલ એડ્રેસ ઉપર શુદ્ધ ગુજરાતી અથવા અંગ્રેજીમાં સ્પષ્ટ વિગતો સાથે કસોટીના એક દિવસ અગાઉ મોકલવા નોંધ લેવી.

-*ત્રીજા તબક્કાના શારિરીક ક્ષમતા કસોટી નો ઝોન વાઇઝ કાર્યક્રમ*-

અ.નં	ઝોન	સમાવેશ થયેલ જિલ્લા	ત્રીજા તબક્કાની શા.ક્ષ.ક. નું સ્થળ	તારીખ / વાર અને રજીસ્ટ્રેશન સમય
૧	ઉત્તર ગુજરાત ઝોન	સાબરકાઠાં, અમદાવાદ પાટણ, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા , કચ્છ ,	એસ.આર.પી. ગ્રાઉંડ , પોલીસ અધિક્ષકશ્રીની કચેરી પાછળ , સેક્ટર -૨૭, ગાંધીનગર જિલ્લો- ગાંધીનગર	૦૬/૦૪/૨૦૧૭ ગુરુવાર સવારે ૪=૦૦થી ૮=૦૦ કલાક સુધી
૨	મધ્ય ગુજરાત ઝોન	વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર,	એસ.આર.પી. ગ્રાઉંડ , પંચમહાલ ડેરી પાસે, ગોધરા, જિલ્લો- પંચમહાલ	૦૮/૦૪/૨૦૧૭ શનીવાર સવારે ૪=૦૦થી ૮=૦૦ કલાક સુધી
૩	દક્ષિણ ગુજરાત ઝોન	ડાંગ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, તાપી, નર્મદા,	પોલીસ પરેડ ગ્રાઉંડ , સુરત ગ્રામિણ - મુખ્ય મથક , ધલુડી , સુરત, તા. - કામરેજ, જિલ્લો.- સુરત ,	૧૦/૦૪/૨૦૧૭ સોમવાર સવારે ૪=૦૦થી ૮=૦૦ કલાક સુધી
૪	સૌરાષ્ટ્ર ઝોન	જુનાગઢ, જામનગર , ગીરસોમનાથ, મોરબી, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ, દેવભુમી દ્વારકા, સુરેંદ્રનગર, રાજકોટ	પોલીસ પરેડ ગ્રાઉંડ , બિલ્ખા રોડ , જુનાગઢ , જિલ્લો- જુનાગઢ	૧૨/૦૪/૨૦૧૭ બુધવાર સવારે ૪=૦૦થી ૮=૦૦ કલાક સુધી

સ્થળ: ગાંધીનગર

તા.૦૧/૦૪/૨૦૧૭

સભ્ય સચિવ

વનરક્ષક ભરતી સમિતી અને

મુખ્ય વન સંરક્ષક, વહીવટ

ગુજરાત રાજ્ય, ગાંધીનગર

Contact No: 079 232 54122

Email Id: apccf.fst.adm@gmail.com,